



A Bank of Tomorrow...!

# SHRI VINAYAK SAHAKARI BANK LTD.

1, Sumeru Bungalows, Nr. Sarthi Hotel, Beside Sarthi Party Plot, Bodakdev Road, Vastrapur, Ahmedabad-54  
Phone : 079 - 26843333, 26843334 • Email : svsbankltd@gmail.com • Web : www.svsbl.com

## મહિલા સ્વરોજગાર લોન સ્કીમ નીચે ધિરાણ અરજી

તારીખ : .....

--

ધી મેનેજર/ઓફિસર

શ્રી વિનાયક સહકારી બેંક લી.

અમદાવાદ

હું નીચે સહી કરનાર ..... આપની  
બેંકમાંથી મહિલા સ્વરોજગાર લોન સ્કીમ નીચે મશીન ખરીદવા માટે / માલ સામાન ખરીદવા માટે રૂ. ....  
અંકે રૂપિયા ..... ની લોન મેળવા માટે  
અરજી કરુ છું. આ બેંકના હાલના તથા વખતોવખત અમલમાં આવતા ધિરાણના નિયમો અને પેટા કાયદાની  
જોગવાઈઓ મને કબુલ મંજુર છે. જો આ ધિરાણ સ્કીમ નીચે સરકારશ્રીની આર્થિક સહાય / સબસીડી / ગ્રાન્ટ મળવાપાત્ર  
બનશે તો આવી રકમ સીધી જ મારા લોન ખાતામાં જમા થાય તે મને મંજુર છે. મારી અરજની વિગત નીચે મુજબ છે:

(૧) અરજદારનું નામ

.....

જન્મતારીખ : ..... ઉંમર : ..... વર્ષ : .....

હાલનો વ્યવસાય : ..... માસિક આવક રૂ. ....

આ બેંકમાં મારો સેવીંસ બેંક ખાતા નંબર : .....

(૨) અરજદારના પતિ/પિતાનું નામ : .....

અરજદાર સાથેનો સંબંધ  પતિ  પિતા (લાગુ પડતું હોય ત્યાં ટીક કરો)

અરજદારના પતિ/પિતાનો વ્યવસાય ..... માસિક આવક રૂ. ....

(૩) અરજદારનું સરનામુ

: ..... પીન કોડ નંબર : .....

ટેલીફોન નંબર : ..... મોબાઇલ : .....

(૪) મકાન પોતાની માલિકીનું છે. : માલીકીનું  ભાડાનું  (લાગુ પડતું હોય ત્યાં ટીક કરો)

કે ભાડાનું છે ?

(૫) ધિરાણ અંગેનો હેતુ : મશીનરી ખરદીવા માટે માલ સામાનની ખરીદી માટે  
(લાગુ પડતું હોય ત્યાં ટીક કરો)

(૬) લોન લીધા બાદ માસિક આવક કેટલી થશે? રૂ. ....

(૭) અરજદારની તેમજ તેમના કુટુંબના સભ્યોનું સંયુક્ત માસિક આવક રૂ. ....

કુલ માસિક ખર્ચ રૂ. ....

કુલ માસિક વધારો (આવક - ખર્ચ) રૂ. ....

નવું મશીન ખરીદવાનું  
છે તેનું નામ

ડિલરનું  
નામ

કોટેશનની  
રકમ રૂ.

માર્જન ૧૦%  
મુજબની રકમ રૂ.

મળવાપાત્ર લોનની  
રકમ રૂ.

(૮) લોનની રકમની માંગણી રૂ. ....

માસિક હપ્તાની રકમ વ્યાજ સહિત રૂ. ....

(૨)

(૧૦) આ તથા અન્ય બેંક/સંસ્થા તરફથી હાતમાં લીધેલ ધિરાણ સગવડની વિગત :

ક્રમ	બેંક/સંસ્થાનું નામ	શાખા	મંજુર ધિરાણની વિગત		તા. .... ના રોજ બાકી રકમ
			તારીખ	રકમ	

(૧૧) મારા અન્ય બેંકમાં ચાલુ / બચત / ડીપોર્ટ ખાતાની વિગત

ક્રમ	ખાતેદારનું	બેંકનું નામ	શાખા	મંજુર ધિરાણની વિગત		તા. .... ના રોજ બાકી રકમ
				પ્રકાર	નંબર	

(૧૨) અરજદારની ઈન્કમટેક્ષની વિગત :

પરમેનાટ એકાઉન્ટ નંબર (PAN): .....

ઈન્કમટેક્ષ રીટર્ન મુજબ કુલ આવક : રૂ. .... નાણાકીય વર્ષ : .....

(૧૩) હું આ બેંકનો સભાસદ / નોમીનલ સભાસદ છું / નથી.

જો હોય તો, સભાસદ નંબર ..... શેર્સની સંખ્યા : .....

(૧૪) હું આ ટર્મ લોનની રકમ વ્યાજ સહિત ઉદ્દેશ્ય માટે હપ્તામાં પરત કરીશ

(૧૫) આથી જાહેર કરું છું કે, આ અરજીમાં લખાયેલા અને અત્રે જાહેર કરેલા તમામ નિવેદનો, વિગતો, ઉત્તરો, સંપૂર્ણ રીતે દરેક બાબતમાં સાચા છે. વળી મેં બેંકના ધારા-ધોરણ, નિયમ કાળજીપૂર્વક વાંચ્યા છે અથવા વંચાયેલ છે. અને તેમાં ભવિષ્યમાં થનાર તમામ સુધારાઓ મને બંધનકર્તા છે. લોન દ્વારા ખરીદવામાં આવેલ મશીનનો અથવા માલ સામાનનો ઉપયોગ મારા ધંધા માટે જ કરીશ. આ મશીન લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી કોઈને વેચીશ નહીં તેમજ બીજો આપીશ નહીં.

(૧૬) મેં આપની બેંકમાં રૂ. .... ની લોન લેવા માટે માંગણી કરેલ છે. હું ખાત્રીપૂર્વક આ લખાણ નીચે સહી કરી બેંકને જણાવું છું કે, બીજી કોઈ બેંકમાંથી અગાર ધીરધાર કરનાર સહકારી મંડળી કે કેન્દ્રિક સોસાયટીમાંથી મેં કોઈપણ પ્રકારની લોન (ધિરાણ) લીધેલ નથી.

સ્થળ : અમદાવાદ

અરજદારની સહી :

તારીખ :

(૪) ભલામણ :

આ અરજદારને ..... વર્ષથી ઓળખું છું. ધિરાણ અરજીની માહિતી મેં વાંચી છે. તેમને ધિરાણ આપવા મારી ભલામણ છે.

ભલામણ કરનાર ડાયરેક્ટરશીનું નામ : .....

સહી : .....

## લોન લેનારની વિગત

- (૧) અરજદારના આવકના પુરાવા અંગેની વિગત, જો ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ રીટર્નની કોપી.
- (૨) લોન લેનારના નામે મિલ્કટ હોય તો તેનું છેલ્લુટેક્ષનું બીલ/સોસાયટીના ચેરમેન/સેકેટરીનો દાખલો (ગમે તે એક)
- (૩) અરજદારના ર ફોટા
- (૪) અરજદારના એરોસના પુરાવા તરીકે તાજેતરનું ઈલેક્ટ્રોનિક બીલ/ટેલીફોન બીલ (ગમે તે એક)
- (૫) અરજદારના ફોટા પ્રુફ માટે પાન કાર્ડ/આધારકાર્ડ/ઈલેક્શન કાર્ડ (ગમે તે એક)
- (૬) અરજદારનું જે બેંકમાં ખાતુ હોય તેના છેલ્લા બે વર્ષનો ઉતારો/સ્ટેટમેન્ટ
- (૭) અરજદારે બધા જ અસલ દસ્તાવેજો (પુરાવા) અરજી સાથે બેંકમાં રજૂ કરવાના રહેશે. જેરોક્ષ કોપી સાથે ચેક કરીને અસલ પુરાવા પરત કરવામાં આવશે.

## શરતો

- (૧) અરજી સાથે અરજદારે સ્વરોજગાર માટે મશીનની ખરીદી કરવાનું કોટેશન જોડવાનું રહેશે. બેંક કોટેશનની રકમના ૮૦% સુધી ધિરાણ કરશે.
- (૨) માર્જનની રકમ (૧૦% કોટેશનની કિંમતના) અગાઉથી અરજદાર દ્વારા બેંકમાં જમા કરાવવા રહેશે.
- (૩) બેંક દ્વારા જે તે ડીલરને બેન્કર ચેક દ્વારા ડાયરેક્ટ પેમેન્ટ કરશે.
- (૪) પેમેન્ટ મળ્યાની સ્ટેમ્પ રસીદ તથા બીલ બેંકમાં આપવાનું રહેશે
- (૫) લોનની રકમ વ્યાજ સહિત ઉદ્ માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે

અરજદારની સહી :

---

## શાખાની ભલામણા

- (૧) અરજીમાં દર્શાવેલ માહિતીની તપાસ / ચકાસણી કરવામાં આવી છે. અરજદારના રહેણાંકના મકાનની / ધંધાના સ્થળની મુલાકાત તા. .... ના રોજ લેવામાં આવી છે.
- (૨) શાખાની ભલામણા નીચે મુજબ છે:

લિમિટ રૂપિયા	મશીનની વસ્તુની કિંમત રૂ.	માર્જન ૧૦%	કુલ માસિક હપ્તાઓ	માસિક હપ્તો વ્યાજ સાથે રૂ.
-----------------	-----------------------------	---------------	---------------------	-------------------------------

- (૩) અરજદારની માસિક હપ્તો ભરવાની ક્ષમતા નીચે મુજબ છે.
- અરજદારની માસિક આવક રૂ. ..... કુટુંબના સભ્યોની માસિક આવક રૂ. .....
- અરજદારનો માસિક ખર્ચ કપાત સાથે રૂ. ..... કુટુંબના સભ્યોની માસિક ખર્ચ રૂ. .....
- અરજદારની નેટ માસિક આવક રૂ. ..... કુટુંબના સભ્યોની કુલ નેટ માસિક આવક રૂ. ....
- (૪) ધિરાણની માંગણીના હેતુ અનુસાર વર્ગીકરણ : પ્રાયોરીટી સેક્ટર   
 (પ્રાયોરીટી સેક્ટર ધિરાણના માસ્ટર સરક્યુલરના આધારે) : નોન પ્રાયોરીટી સેક્ટર   
 (લાગુ પડતું હોય ત્યાં ટીક કરો.)

### શરતો

- (૧) અરજદારે જે મશીન ખરીદવાનું છે તેના ઉપર બેંકનો હાઈપોથીકેશન ચાર્જ રહેશે.
- (૨) મંજુર કરેલ રકમનું પેમેન્ટ અરજદાર પાસેથી જરૂરી માર્જનની રકમ મેળવ્યા બાદ ડાયરેક્ટ ડીલરને બેંક મારફત કરવાનું રહેશે. પેમેન્ટ મળ્યની રસીદ તેમજ બીલ બેંકમાં આપવાનું રહેશે.
- (૩) લોનની રકમ વ્યાજ સહિત કુલ ઉદ્ધ માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.

તારીખ : ..... એકાઉન્ટન્ટ/ઓફિસરની સહી : .....

### હેડ ઓફિસની મંજુરી અંગોની નોંધ

શાખાના મેનેજર દ્વારા કરવામાં આવેલી ભલામણા આધારે તેમજ શરતોને આધિન મહિલા સ્વરોજગાર સ્કીમ નીચે મંજુર / નામંજુર કરવામાં આવે છે. (લાગુ પડતું હોય તે રાખો)

મંજુર કરેલ રકમ રૂ.	વ્યાજનો દર	કુલ માસિક હપ્તા	માસિક હપ્તાની રકમ રૂ.
--------------------	------------	-----------------	-----------------------

આ ઉપરાંત નીચેની શરતો ઉમેરવામાં આવે છે :

(૧)

(૨)

આસિ. મેનેજર	જનરલ મેનેજર	મેનેજર ડિરેક્ટર	વાઇસ ચેરમેન	ચેરમેન
-------------	-------------	-----------------	-------------	--------